



To,

Department of Corporate Services,

**BSE Limited** 

25th Floor, Phiroze Jeejeebhoy Tower, Dalal Street, Fort,

Mumbai – 400 001

**Scrip Code: 541945;** 

**Security ID: RANJEET** 

Dear Sir/Madam,

Subject: - Copy of Newspaper Advertisement published with respect to corrigendum issued to the notice of 30<sup>th</sup> Annual General Meeting.

In terms of circular No. 20/2020 dated 5<sup>th</sup> May, 2020 issued by Ministry of Corporate Affairs ('MCA circular') read with Regulation 30 and Regulation 47 of the SEBI (Listing obligations and Disclosure Requirements) Regulations, 2015 please find enclosed herewith copies of newspaper advertisements published in Free press Gujarat (English) and Lokmitra (Gujarati) on Tuesday, 12<sup>th</sup> December, 2023 giving corrigendum to the notice of 30<sup>th</sup> Annual General Meeting of the company to be held on Wednesday, 13th December, 2023 and all other required information as provided under the MCA Circular.

Kindly consider the same and take on your record.

Yours faithfully. For, RANJEET MECHATRONICS LIMITED

Shah Ankita Shyamlal Callet, cond

ANKITA SHAH COMPANY SECRETARY AND COMPLIANCE OFFICER

Encl: As above

RANJEET MECHATRONICS LTD.

(FORMERLY KNOWN AS: RANJEET ELECTRIC PVT. LTD. | DESTINY ZONE SECURITY SYSTEMS PVT. LTD. | HIMGIRI **SOLUTIONS PVT. LTD.)** 

REGISTER ADDRESS: - Block A. #407 4th Floor Dev Aurum, Anandnagar Cross Road, Prahaladnagar Road, Ahmedabad. 380015. Gujarat. Tel.: 91 79 40009390. Email: info@ranjeet.co.in and

cs.compliance@ranjeet.co.in ||

Website:-www.ranjeet.co.in CIN NO. L31100GJ1993PLC019635

# 'શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા'ઃ એસ.ટી.ને સ્વચ્છતા માટે આદર્શ બનાવીએ

કટિબદ્ધ છે. તે અંતર્ગત રાજ્ય સરકારે

કેટલાક નવીન આયામો હાથ ધર્યા છે

જેમાં બસ સ્ટેશન ખાતે વિરામના સમયે પહોંચેલી એસ .ટી બસ સ્વચ્છતા

કર્મીઓ દારા ૧૦ મિનીટમાં નીટ એન ક્લીન કરી દેવામાં આવે ત્તે પ્રકારની

વ્યવસ્થા ઉભી કરવામાં આવશે

ઉપરાંત નિગમ દ્વારા પી.પી.પી ધોરણે

વિકસાવેલા બસ સ્ટેશનો સિવાયન

તમામ બસ સ્ટેશન ઉપર શૌચાલયના

વપરાશ માટે લેવામાં આવતા પે એન્

યુઝ ચાર્જીસ પણ માર્ચ-૨૦૨૪ સુધીમાં સંપૂર્ણરીતે બંધ કરીને પે એન્ડ યુઝ

શૌચાલયોની સુવિધા નિઃશુલ્ક કરી દેવાશે. પે એન્ડ યુઝ થકી નિગમને સવા કરોડ રૂપિયાની આવક થાય છે.

પરંત પ્રજાના હિત માટે આ ૨કમ જતી

કરી પે એન્ડ યુઝ શૌચાલય નિશુલ્ક સેવા આપવાનો પ્રજાલક્ષી નિર્ણય કર્યો

છે. તેમણે કહ્યું કે, હવે મુસાફરો બસ અને બસ સ્ટેશનોની સ્વચ્છતાનો

અભિપ્રાય પણ આપી શકશે. જે માટે ખાસ પેસેન્જર ફિડબેક સિસ્ટમ ઊઇ

કોડ હશે. નિગમના અધિકારીશ્રીઓ દ્વારા સ્વચ્છતાની કામગીરીનું સમયસર

ઇન્સ્પેક્શન અને ઇવેલ્યશન કરાશે

આ ઊઇ કોડ મારફતે બસ અને ડેપોની

ગાડાઇ કાર્ડ ૧૯૬૧ નહા ગાડા કરે સ્વચ્છતા અંગે ફિડબેક આપવા સૌ નાગરિકોને મંત્રીશ્રીએ અપીલ કરી છે

સરકારી એસ.ટી બસોને ખાનગી

સરકારી અસ.ટી બસાન ખાનગા લકઝરી જેવી બનાવવાની નેમ સાથે મંત્રીશ્રીએ કહ્યું કે, એસ.ટી.નગમની ૧૯૮૧ બસોમાં ડસ્ટબીન મૂકવામાં આવી છે. જ્યારે બાકી રહેતી અન્ય બસોમાં પણ આગામી ૧૦ દિવસમાં

ડસ્ટબીન મૂકી દેવામાં આવશે. તે

ઉપરાંત ડેન્ટીંગની જરૂરીયાતવાળા પ૪૧ વાહનોને ૬૦ દિવસમાં દુરસ્ત

કરવામાં આવશે. કલર કામની

જરૂરીયાતવાળા ૫૧૬ વાહનોની આગામી ૧૦૦ દિવસમાં કામગીરી

પર્ણ કરવામાં આવશે. સીટની

રૂપ કરવાના આવતા. સાટના રીપેરીંગની જરૂરીયાતવાળા ૪૮૨ વાહનોના રીપેરીંગની કામગીરી આગામી ૧૫ દિવસમાં પૂર્ણ કરી

તમામ સરકારી એસ.ટી બસને ખાનગી

બનાવી દેવામાં આવશે.

ભપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ભૂપખૂર્ભાઇ પટલેમાં નાગદરામ છે. સમગ્ર રાજ્યમાં 'સ્વચ્છતા હી સેવા' અભિયાન વેગવંતુ બન્યુ છે ત્યારે રાજ્યના નાગરિકોની મુસાફરી સ્વચ્છ અને સુગમ બની રહે તે આશય સાથે આજે ગાંધીનગર એસ.ટી ડેપો ખાતેથી "શુભ યાત્રા, સ્વચ્છ યાત્રા" કેમ્પેઇનનો રાજ્યવ્યાપી શુભારંભ વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષસંઘવીએ

ગાંધીનગર, મુખ્યમંત્રી શ્રી નાગરિકોને યાતાયાતની સુવિધા વધુ સદઢ કરવા માટે આગામી ૧૦ મહિના સુધી દર મહિને ૨૦૦ એસ.ટી બસો એટલે કે, ૧૦ મહિનામાં કુલ ૨૦૦૦ નવી એસ.ટી બસો મુસાફરોની સુખાકારી અને શુભ યાત્રા માટે ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવામાં આવ્યુ હોવાનું મંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે. "શુભ યાત્રા સ્વચ્છ યાત્રા" કેમ્પેઇનનો શુભારંભ કરાવતા મંત્રી શ્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, નાગરિકોની કરાવ્યો છે. હર્ષ સંઘવીએ કહ્યું કે, નાગરિકાની તેની સાથે જ રાજયના મુસાફરી સ્વચ્છ અને સુગમમય બની

# અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ કોઈ સંસ્થા નથી, પરંતુ તે રાષ્ટ્રના પુનર્નિર્માણ માટેનું આંદોલન છેઃ અમિત શાહ



અમદાવાદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અમિત શાહે મુખ્ય અતિથિ તરીકે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના દ૯માં રાષ્ટ્રીય સંમેલનનું ઉદ્દઘાટન કર્યું હતું . આ પ્રસંગે શાહે સંદેશ આપ્યો હતો કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ કોઈ સંગઠન નથી, પરંતુ તે રાષ્ટ્રના પુનર્નિમણિ માટેનું આંદોલન છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગામી ૨૫ વર્ષમાં ભારતને વિશ્વનું સૌથી મહાન રાષ્ બનાવવાનો સંકલ્પ લેવાનું આહ્વા કર્યું છે. અમે આ પરિપુર્ણ કરવા માટે સંકલ્પબાદ અને પ્રતિબાદ છીએ જે યુવાનો પોતાની કારકિર્દીથી દેશને સુંદર બનાવે છે તે જ સાચા અર્થમાં

શિક્ષણ મેળવે છે. આજે, મોદીજીના નેતૃત્વમાં અને અમિત શાહના સક્ષમ માર્ગદર્શન હેઠળ, ભારત એવા તબક્કે પહોંચી ગયું છે જયાં વિશ્વ દરેક समस्याना (१६ बनी आशा साथे ભારત તરફ જોઈ રહ્યું છે. આખો દેશ જાણે છે કે શાહની નીતિઓ હેઠળ દેશમાં ઘૂસણખોરીને શોધી કાઢવા, કાઢી નાખવા અને દેશનિકાલ કરવાનો સંકલ્પ છે. કાઉન્સિલે સમગ્ર દેશમાં ધુસણખોરી સામે જનજાગૃતિ લાવવાનું કામ કર્યું છે. ભાષા અને શિક્ષણની ચળવળ હોય કે સંસ્કૃતિની જાળવણીની હોય, દરેક ક્ષેત્રમાં વિદ્યાર્થી પરિષદે યુવાનો દ્વારા સમાજને આત્મવિશ્વાસનું મહત્વ સમજાવ્યું છે. (૧૯-૧૦)

### મુક્તા A2 સિનેમાસે રતાંજલિ સ્ક્વેર ખાતે થ્રી-સ્ક્રીન મલ્ટિપ્લેક્સના ઉદ્ઘાટનની સાથે વિસ્તરણ કર્યું છે. અત્યાધુનિક મલ્ટીપ્લેક્સમાં ત્રણ



અમદાવાદ, અમદાવાદ-અસાધારણ સિનેમેટિક અનુભવો પ્રદાન કરવામાં અગ્રણી મુક્તા A2 સિનેમાસ રત્નાંજલિ સ્કવેર ખાતે તદ્દન નવા થ્રી-સ્ક્રીન્ મલ્ટિપ્લેક્સના ઉદઘાટનની જાહેરાત કરતાં રોમાંચિત છે. આ વિસ્તરણ ફિલ્મ પ્રેમીઓને લક્ઝરી, ટેક્નોલોજી અને આહલાદક કલાના મિશ્રણ સાથે પ્રદાન કરવાની કંપનીની પ્રતિબદ્ધતામાં વધુ એક સીમાચિક્ષરૂપ

સ્ક્રીન છે, જેમાંથી દરેક શાનદાર અને ભવ્ય મૂવી જોવાનો અનુભવ કરાવે છે. રત્નાંજલિ સ્ક્વેર ખાતે મુક્તા A2 સિનેમાસ ડોલ્બી સાઉન્ડ, લેસર રદ્ધ પ્રોજેક્શન અને લક્ઝુરિયસ બેઠકોથી સજ્ર છે. જેથી વડ્યું. ૧૫ જોડાવા સજ છે. કવા કરીને અહીં વિતાવેલી દરેક ક્ષણ યાદગાર બની રહે. આ નવા સાહસની વિશેષતાઓમાંથી એક સાહસત્તા (વશ્યપતાં આમાંથા એક રાંપણ અનુભવ છે. ફિલ્મ જોવા આવનાર તાજા બને, સ્વાદિષ્ટ ભોજનના વિકલ્પનો આનંદ ઉઠાવી શકે છે. જેના લીધે તેમનો સમગ્ર મનોરંજનનો અનુભવ શ્રેષ્ઠ થઈ જશે. સ્વાદિષ્ટ નાસ્તાથી લઇને સ્વાદિષ્ટ ભોજન સુધી મુક્તા A2 સિનેમાસે સફરને પૂરક બનાવે છે. (૨૦-૪)

# ગુજરાત સાયન્સ સિટી ખાતે નોબેલ પ્રાઈઝ ડેની ભવ્ય ઉજવણી કરવામાં આવી



અમદાવાદ, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત સાયન્સ સિટીમાં નોબેલ પુરસ્કાર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી. દર વર્ષે ૧૦ િડસેમ્બરે વૈજ્ઞાનિક આલ્ફ્રેડ નોબેલની પુરયતિથિ નિમિત્તે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત સાયન્સ સિટીમાં કરવામાં આવેલી લાવન્સ (સટાના કરવાના આવલા ઉજવણીમાં IPR (ઈન્સ્ટીટ્યૂટ ઓફ પ્લાઝ્મા રીસર્ચ - ગાંધીનગર)ના ડીન ડો. પારિતોષ ચૌધરી, IPRના વૈજ્ઞાનિકડો. છાયા ચાવડા તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા. IPRના ડીન ડો. પારિતોષ ચૌધરીએ વિદ્યાર્થીઓને નોબેલ પારિતોષિક અને

મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત ડો. છાયા ચાવડાએ વિદ્યાર્થીઓને પ્લાઝમા અને તેના ઉપયોગ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં સહભાગી થનારા વિદ્યાર્થીઓએ ગુજરાત સાયન્સ સિટીના હોલ ઓફ સાયન્સ/ હોલ ઓફ સ્પેસ નજીક નોબેલ પાથ પર ઊભા કરાયેલા નોબેલ પુરસ્કાર વિજેતાઓની હસ્તપ્રત પણ નિહાળી હતી. ઉલ્લેખનીય છે કે લોકો અને વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે રૂચિ વધે તે માટે ગુજરાત સાયન્સ સિટી સતત કાર્યરત છે, જેના માટે અહીં અવારનવાર વિજ્ઞાનલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. –

Printed and Published by MAYUR C. BHATT on behalf of KALYANI PUBLIATION PVT. LTD. and Printed at : Dhart Printers C-3, Shankar Chember, Nr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published From KALYANI PUBLIATION PVT. LTD. 201, 202, 208 Nandan complex, opp mithakhali riy crossing, mithakhali, ahmedabad. Editor : Mayur C. Bhatt

# વરસાદ બાદ બનાસકાંઠામાં પાક નુકસાની સર્વે શરૂ

રાજ્યમાં ગયા અઠવાડિયે થયેલા માવઠાથી ઠેર ઠેર મોટા નુકસાનીના સમાચાર સામે આવ્ય હતા, રાજ્યના તમામ તાલુકાઓમ માવઠાએ ભારે તબાહી મચાવી દીધી માવઠોએ ભાર તેળાહા મચાવા દાયા હતી. ઉત્તર ગુજરાતથી લઇને દક્ષિણ અને મધ્ય ગુજરાત, તથા સૌરાષ્ટ્ર-કચ્છના કેટલાય વિસ્તારોમાં માવઠાથી રવિવાકને મોટુ નુકસાન પહોંચ્યુ હતું, આ નુકસાની બાદ સરકારા સામે વિવિધ ખેડૂત સંગઠનો સરકાર સામ ાવાવય ખડૂત સગઠના અને રાજકીય નેતાઓએ પાક નુકસાની માટે માંગ કરી હતી, જે પછી હવે સરકારે પાક નુકસાની સર્વેની કામગીરી શરૂ કરી છે, અત્યારે પાક નુકસાની સર્વે બનાસકાંઠામાં શરૂ થયો છે. ગુજરાતમાં માવઠાથી થયેલા નુકસાન અંગે હવે બનાસકાંઠા જિલ્લામાં સરકાર સર્વે કરાવી રહી છે, ભારતીય કિસાન સંઘની રજૂઆત બાદ બનાસકાંઠામાં સર્વેની કામગીરી શરૂ કરાઇ છે. ખાસ વાત છે કે, માવઠાથી જિલ્લામાં સૌથી વધુ અને મોટુ નુકસાન એરંડાના પાકને પહોંચ્ય હતુ. અત્યારે જિલ્લાના પાલનપુર, કાંકરેજ, દિયોદર અને ભાભરમાં પાકા સર્વે શરૂ થયા છે. આની સાથે સાથે થરાદ, દાંતા, સૂઇગામમાં પણ ટીમો સાથે ગ્રામસેવકો અને તલાટી સર્વે કરશે. ખેતીવાડી અને બાગાયતી પાકોમાં સ્થાનિક ગ્રામસેવકો અને તલાટીઓ નુકસાનીનો તાગ મેળવશે. કમોસમી વરસાદના કારણે ખેતી પાકને થયેલા નુકસાનીનો રિપોર્ય એક સપ્તાહમાં સોંપવા આદેશ કરવામાં આવ્યો છે. એક સપ્તાહમાં નુકસાનીનો સર્વે પૂર્ણ કરી મુખ્યમંત્રી સમક્ષ રિપોર્ટ મુકાશે. આ અંગે કૃષિમંત્રી રાઘવજી પટેલે અધિકારીઓને સ્પષ્ટ આદેશ આપ્યો છે. જે સ્થળે વધુ કમોસમી વરસાદ થયો ત્યાં પ્રાથમિકતાના ધોરણે સર્વે કરવા આદેશ અપાયો છે. કમોસમી વરસાદથી થયેલા પાકને નુકસાન અંગેની સમીક્ષા બેઠકમાં કૃષ્મિમંત્રીએ આદેશ આપ્યો છે. પ્રાથમિક અંદાજ મજબ રાજ્યમાં ત્રાથાનક અઠાજ નુજબ રાજ્યના ત્રણથી ચાર લાખ હેક્ટરમાં ફેલાયેલા કપાસ, એરંડા અને તુવેરના ઉભા પાકને વરસાદને કારણે અસર થઈ છે. કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે.

## ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારસ્તાન પકડાયું પપપ કિલો નકલી ઘી નો જથ્થો કબજે

જામનગર,જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં એક શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનમાં ડપ્લીકેટ ઘી બનાવવાનું કારસ્તાન ચલાવવામાં આવતું હોવાની બાતમીના આધારે એસ.ઓ.જી. ની ટુકડીએ ફુડ એન્ડ,ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને દરોડો પાડી એક મહાજન શખ્સને અટકાયતમાં લઈ તેની પછપરછ શરૂ કરી છે અને લઇ હવા મૂછવાઇ સર્વક લે છે ગેલ તેના કબજામાંથી પપપ કિલો ડુપ્લીકેટ મનાતો ઘીનો જથ્થો કબજે કર્યો છે, અને એફએસએલ મારફતે લેબોરેટરીમાં મોકલી આપ્યો છે આ દરોડાની વિગત એવી છે કે એસ.ઓ.જી.ની ટુકડીને ચોક્કસ બાતમી મળી હતી કે, જામનગરમાં દિગ્લિજય પ્લોટ શેરી નંબર ૪૯ માં રહેતા ચિરાગ મનસુખલાલ હરિયા નામના મહાજન શખ્સ દ્વારા પોતાના રહેણાંક મકાનની અંદર બનાવટી ધી તૈયાર કરવાનું અને તેનું ખાનગીમાં વેચાણ કરવાનું કારસ્તાન ચલાવવામાં આવી રહ્યું છે તેવી ચોક્કસ બાતમીના અ એસ.ઓ.જી. ની ટુકડીએ ફૂડ એન્ડ

ડ્રગ્સ વિભાગની ટીમને સાથે રાખીને આજે સવારે ઉપરોક્ત રહેણાંક મકાન પર દરોડો પાડ્યો હતો.તે દરોડા દરમિયાન મકાનમાંથી ૧૫ કિલો, ૧૦ કિલો અને કિટલા સહિત ૫૫૫ કિલો ધી નો જથ્થો મળી આવ્યો હતો. આથી એસ.ઓ.જી.ની ટુકડીએ કુલ ૨,૬૫,૦૦૦ ની કિંમતનો નકલી ધીનો જથ્થો કબજે કરી લીધો છે. અને કડ એન્ડ ડગ્સ વિભાગની ટીમ દ્વારા તેન ર્મેળવીને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જેનો રિપોર્ટ આવી ગયા પછી મહાજન શખ્સ સામે આગળની કાર્યવાહી હાથ ધરાશે.અને તેના કબજામાંથી પપપકિલો,ડૃપ્લીકેટ મનાતો ઘીનો જથ્થો કબજે કર્યો છે, અને એફએસએલ મારફતે લેબોરેટરીમાં મોકલી આપ્યો છે. આ દરોડાની વિગત એવી છે કે એસ.ઓ.જી.ની ટકડીને ચોક્કસ બાતમી મળી હતી કે જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૪૯ માં રહેતા ચિરાગ મનસુખલાલ હરિયા નામના મહાજન

# પ્રેસ્ટોનિક એન્જિનિયરિંગ લિમિટેડ પબ્લિક આઈપીઓ ૧૧ ડિસેમ્બરે ખલ્યો



અમદાવાદ, મેટ્રો રેલ રોલિંગ ક, મેટ્રો રેલ સિગ્નલિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ઉત્પાદનમાં રોકાયેલ પ્રેસ્ટોનિક એન્જિનિયરિંગ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. ૨૩.૩૦ કરોડ કરોડ એક્ત્ર . કરવાની યોજના ધરાવે છે. કંપનીનો જીસ્ઈ પબ્લિક ઇશ્યૂ ૧૧ ડિસેમ્બરના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલ્યો. પબ્લિક ઇશ્યૂની આવકનો ઉપયોગ પ્લાન્ટ એન્ડ મશીનરી ખરીદવા. અમક એન્ડ મશીનરી ખરીદવા, અમુક ઋણની ચૂકવણી માટે, કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા અને સામાન્ય કોર્પોરિટ હેતુઓ માટે કરવામાં આવશે. ફિનશોર મેનેજમેન્ટ સર્વિસ લિમિટેડ ઇશ્યૂની ાજનાન્દ્ર સાપસ ાલામદડ ઇશ્યુની લીડ મેનેજર છે. પબ્લિક ઈશ્યુ ૧૩ ડિસેમ્બરે બંધ થશે. આઈપીઓમાં રૂ ૭૨ પ્રતિ શેર (ઇક્વિટી શેર દીઠ ૩ કરના પ્રીમિયમ સહિત) ની કિંમતે રૂ ૧૦ની ફેસ વેલ્યુના ૩૨,૩૬,૮૦૦ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યુનો સમાવેશ ઇક્વિટી શરના ફશ ઇચ્યૂના સમાવશ થાય છે છે જેનું મૂલ્ય કુલ રૂ. ર. ર. ૩.૩૦ કડોડ સુધીનું છે. અરજી માટે લક્ષનમ લોટ સાઈઝ ૧૬૦૦ શેર છે જેનું મૂલ્ય પ્રતિ અરજી રૂ. ૧.૧૫ લાખ જેટલું છે. આઈપીઓ માટે રિટેલ ફાળવણી ઇચ્યૂના ૫૦% પર રાખવામાં આવી છે. માર્કેટ મેકર રિઝર્વેશન ભાગ ૧,૬૩,૨૦૦ ઇક્વિટી શેર છે. (૧૮-૨)

# બોર કેન્સરના કોષ સામે લડશે, શરદી-ખાંસીમાં આપશે રાહત

અમદાવાદ, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. હવે ખેતરમાં શેરું આત વેઇ ગઇ છે. હવે ખતરના બોરડીના ઝાડ પણ બોર ઉગવાનું શરૂ થઈ જશે. ગુલાબના ફૂલની જેમ બોર તોડતી વખતે પણ કાંટા વાગે છે અને લોહી નીકળે છે. પરંતુ તેમ છતાં એનો સ્વાદ એટલો મીઠો હોય છે કે, લોકો तेने तो खा वशर रही शक्ता नथी જોકે તેઓ જાણતા નથી હોતા કે આ બોર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. શિયાળો પરો થતાંની સાથે જ તેઓ ફરીથી અદશ્ય થઈ જાય છે. ઘેટાં અને બકરાં આ ઝાડનાં પાન ખાય છે. આ પ્રાણીઓ માટે આ પાંદડા ખૂબ જ ફાયદાકારક છે. બોરના પાંદડાઓને રાજસ્થાની ભાષામાં પાલો પણ કહેવામાં આવે છે. આયુર્વેદિક રકા કહેવાના ગાય છે. ગાલુવાઇક ડૉક્ટર અમિત ગેહલોતના જણાવ્યાનુસાર, બોર ખાવાના ઘણા ફાયદા છે. બોરની તાસિર ગરમ હોય છે. તેથી તેને શિયાળામાં ખાવામાં આવે છે. તેનું સેવન કરવાથી પાચન શક્તિ મજબત બને છે. તેનાથી શરીરમાં ગરમી જળવાઈ રહે છે, જે શરદી અને ખાંસીમાં રાહત આપે છે. રોગપ્રતિકારક શક્તિ પણ વધારતા બોર કેન્સરના કોષો સામે લડવામાં પણ મદદરૂપ થાય છે. તેનું સેવન કરવાથી ઊંઘ સારી રીતે આવે છે. આ ઉપરાંત, વિવિધો લિકેનો લ્સ બોરમાં બારમા વિવિધાલિફનાલ્સ, પોલિસેકેરાઇડ્સ, ન્યુક્લિયોટાઇડ્સ, એમિનો એસિડ્સ, ડાયેટરી ફાઇબર, ફેટી એસિડ્સ, આલ્કલોઇડ્સ જૈવ રુદા બાસરૂસ, બાલ્કલાઇટ્સ જય સક્રિય પદાર્થી હોય છે, જેની શરીરને જરૂર હોય છે. ડૉ. અમિત ગેહલોતે વધુમાં જણાવે છે કે, બોરમાં કેલરી એછી હોય છે, પરંતુ તેમાં ફાઈબર, વિટામિન્સ અને મિનરલ્સ પુષ્કળ

# બનાસકાંઠા જીલ્લાના દાંતા તાલુકાના હડાદ ગ્રામ પંચાયત ખાતે "વિકસિત ભારત સંકલ્પ યાત્રા" અંતર્ગત લોકોને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ કરાયા ુ લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડ અને ૧૧ લાભાર્થીઓને ઉજ્જ્વલા યોજનાનો સ્થળ પર લાભ અપાયો, ટી.બી.ના ૬૧ અને સિકલસેલ એનીમિયાના ૧૮ દર્દીઓનું સ્ક્રીનીંગ કરાયું



અમદાવાદ.

., બનાસ શંદા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ આદિજાતિ વિસ્તાર દાંતા તાલુકામાં ફરી રહ્યો છે.

જેના ભાગરૂપે દાંતા તાલકાના હડાદગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચતાં ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ લોકોને સરકારની વિવિધ ૧૭ જેટલી યોજનાનો લાભ ાતાવવ ૧૭ જટલા વાજનાના લાભ મેળવવા અંગે યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી.

રથદ્વારા ગામમાં કુલ ૧૬૬ જેટલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાયા હતા. જેમાં ૪૧ લાભાર્થીઓ ને

### પશ્ચિમ રેલવે – અમદાવાદ કિવિઝન

હેવી પ્રમુટી વર્ક બેન્સીઝની આપૃતિ અને સંસ્થાપન (1) કેમ્પ્ર સંભર એન-કોમેલ-વીદીએ-137-ડબ્યુંથ-19-20-42 વા.06/12/2023 (2) ક્ષમનું મામ લોકો સેદ વરા ખાતે ફોઈમ નં KOVI/286/VTA Alt 1 પુજા બે લોક બેન્સીઝની આપ્ર્રિત કેમ્પ્ર પ્રમાન પાકે કેમ્પ્રુપ્ટ કર્યું બેન્સીઝની આપ્ર્રિત એન સંસ્થાપન પાકે કેમ્પ્રુપ્ટ કાર્યું (3) ક્ષમથી અંદ્રાસ્ત્ર પાકાર રે1.85/53/2/ (4) સ્પત્ર કનાશેજની પાકાર રૂપના (5) અનેશ્વ અની श्रमचे शेहो औ twitter.com/WesternRlv

#### રણજીત મેકાટોનિક્સ લીમીટેડ

#### કંપનીની વાર્ષિક સામાન્ય સભાની સૂચના માટેનો પત્રવ્યવહાર

કંપનીની વાર્ષિક સામાન્ય સભાની સૂચના માટેનો પત્રવ્યવહાર અને RANJEET MECHATRONICS LIMITED (ઉપની) ના તમામ દેશપાડોનું યાન નાવેખર, ૨૦૨૩ ના ઉજ પ્રશાસિત કરોશી નોશિક તાર કોરીએ છીએ (જેક્ક્રોમની મુક્યુલર, ૧૩મીએ કંપનીના કેપારા કોર્યા કોર્યા કાર્યા કોર્યા કોર્યા કાર્યા કોર્યા કાર્યા કોર્યા કાર્યા કા

તારીખ: ૧૧-૧૨-૨૦૨૩

આયુષ્યમાન કાર્ડ વિતરણ કર્યા હતા. ના તુમારા કારા સારક્ષ કરા હતા. તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા ત્રોજનાના ૧૧ લાભાર્થીઓને નવા કનેક્શન અપાયા હતા. તેમજ પ લાભાર્થીઓના નવા કનેક્શન માટેની નોંધણીની કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઉપરાંત ટી. બી. સ્ક્રીનીગ ૬૧ દર્દીઓ અને સિકલસેલ એનીમિયા સ્ક્રીનીંગ ૧૮ દર્દીઓના કરવામાં આવ્યા હતા. ૧૨૮ જનરલ લાભાર્થીઓ સહિત 996

અંતર્ગત સરકારની વિવિધ યોજનાનો પ્રસાર પ્રચાર કરતો રથ આદિજાતિ વિસ્તાર દાંતા તાલુકામાં લાભાથાં અન્ય ... લાભાર્થીઓએ વિકસિત ભારતના સંકલ્પના શપથ ગ્રહણ કર્યા હતા. ગામના તલાટીશ્રી પટેલ

કરી રહ્યો છે. જેના ભાગરૂપે દાંતા તાલુકાના હડાદ ગામે વિકસિત

ભેગડીયા, ગ્રામસેવક ચૌધરી વિષ્ણુભાઈ , આચાર્યશ્રી સરગરા નાનજીભાઈ સહિતના

યાયજીયાઇ સાહાયયા કર્મચારીઓએ ગ્રામજનોને વિવિધ

યોજનાઓનો લાભ લેવા પ્રેરણા પુરી

પાડી હતી.બનાસકાંઠા જિલ્લામાં

વિકસિત ભારત સંકલ્પ યાત્રા

#### શ્રીરામ હાઉસિંગ ફાયાનાન્સ લીમીટેડ

SHRIRAM

. ઓફિસ: ઓફિસ નં.૧૨૩,અન્ગપ્પાનૈકેન સ્ટ્રીટ, ચેશાઈ-હેડ ઓફિસ: લેવલ ૩, વોક્હાર્ડ ટોવર્સ, ઈસ્ટ વિન્ગ, સી-૨ બાંદ્રા- ફુલાં કોમ્પ્લેક્સ, બાંદ્રા (ઈસ્ટ), મુંબઈ- ૪૦૦ ૦૫

#### ભૌતિક કબ્જા નોટીસ

આપાડિક જાતાવવાનું કે નીચે સાંકડ કરતા ચીડામ હાઇસિંગ કાયનાન્સ લિમીટે. એસએચએકએલ) ના અધિકૃત અધિકારીએ સિક્યોરીટાઇઝેશન અને રિકન્સ્ટ્રકશન બોક કાયનાન્સિયલ એસેટ્સ અને એન્કોર્સમેન્ટ ઓફ સિક્યોરીટી ઇન્ટરેસ્ટ એક્ટ્ ૨૦૦૨ (**જણાવેલ કાયદા**) નિયમો, ૨૦૦૨ (જણાવેલ નિયમો)ના નિયમ ૩ સાથે વંચાતી કલમ૧૩(૧૨) હેઠળ મળેલી સત્તાની રૂએ નીચે કોપ્ટકમાં જણાવેલ કરજદારોને . જણાવેલ માંગણા નોટીસોમાં જણાવેલ ૨કમ પરત ચુકવવા માંગણા નોટીસો જારી કરી હતી. કરજદારો ૨કમની પુન:ચુકવણી કરવામાં નિષ્ફળ ગયા છે. પરિણામે કરજદારો અને

કરજાઇલ ટકમમાં ધુમાનુકઅક્કા કરવામાં માન્ય જ્યાર છે. પાસના રજાઇલ અન્ન જ્યારે જનાનો નોરીસ આપવામાં આવે છે કે અહીં નીચે સહી કરનાર અધિકૃત અધિકારીએ માનનીય ચીક જધુડિશીયલ મેજિસ્ટ્રેટ, રાજકોટમાં કિમીનલ મિસ્ક એપ્લીકિશન નં. ૨૯૦૨/૨૦૦૩ જજામેન્ટ તારીખ ૦૧/૧૧૦૨૭ના રોજ અને ક્રિસ્મોરિટીઝેશન એન્ડ રિકન્ટ્રેટ્સન ઓક કાયનેન્શીયલ એસેટ્સ એન્ડ એન્કોસેમ્ટ ઓક સિક્યોડીટીઝેશન એન્ડ રિકન્ટ્રેસ્ટ અકેક, ૨૦૦૨ ના સરકેસી એક્ટ ૨૦૦૨ના નિયમ ૧૪ અને ૧૩ (૪) વંચાણે લેતા મળેલી સત્તાની રૂએ ૧૦/૧૨/૨૦૦૩ના રોજ કાર્યવાહી કરી નીચે વર્ણન કરવામાં આવેલ તેના/તેણી નામે રહેલ મિલ્કતનો ભૌતિક કબ્જો

મળવી લીધા છ. કરજદાર અને ખાસ કરી જાહેર જનતાને મિલકત સાથે કોઈ સોદો ન કરવા સાવધ કરવામાં આવે છે અને મિલકત સાથેનો કોઈપણ સોદો શ્રી રામ હાઉસિંગ ફાયનાન્સ લી.ની નીચે જણાવેલ ૨કમ તેમજ તેના પર વ્યાજના ચાર્જને આધિન રહેશે. કરજદારો ધ્યાન આપે કે આ કાયદાની કલમ ૧૩ ની પેટા કલમ (૮) મજબ આ ગીરો મિલકત મુકત કરાવવાનો સમય મળે છે.

કરજદારનું નામ અને સરનામું	માંગણા નોટિસ મુજબ બાકી રકમ	ગિરો મિલકતનું વર્ણન
ખુહદેવ વર્ષાભેન ભરતભાઈ, ર. ખુહદેવ ઘરા ભરતભાઈ, ર. ખુહદેવ ધીમિટ ભરતભાઈ, સરનામું ને, ર. અને 3:- સ્ટ્રીટ નં. એ/3, ફુલવાડી રોડ, પટેલ સમાજ પાતે, જેતપુર, રાજકોટ - ક0-300 અન્ય સરનામું ૧, ર. અને 3:- ખોટ નં. ૧, કમી રાજનન, શ્રીજી પાર્ક, કુમાર રેસીડેન્સી પાઇળ, ઓક જુનાગઢ રોડ, જ્યો ટાવર પાત્રે, એરિયા:- શ્રીજી પાર્ક, કુમાર રેસીડેન્સી પાઇળ, સેક જુનાગઢ રોડ, જ્યો ટાવર પાત્રે, શ્રીજી પાર્ક, કુમાર રેસીડેન્સી પાઇળ, તેક સ્ટુર્ગ જેતપુર, નવાગઢ, ડિસ્ફીક:- રાજકોટ. અન્ય સરનામું નં. ૧:- બુદદેવ વર્ષાખેન ભરતભાઈ, સરનામું: કિઠ્ઠા એન, પંક્રળ નિર્દેગ્સ કોમ્પ્લેશ, મનવા સ્ટ્રીય, જેતપુર, રાજકોટ- ૩૬0390.	રા. ૩૩.૫૯.૩૯૮લાખ બે વિશ્વસાર્ય તેવાલ બે વિશ્વસાર્ય કે લાક્ષ્ટ જે ૦૮/૦૯/૨૦૩૩ સુધી ફિસ્સ ઓફ લોન એકાઇન્ટ નં. SEH.HITPR0000 121 અને રૂદ પૂરુ ૭,૨૪૧/- (સુધ્યા એક લાખ સુદાલાક્ષ્ય એક લાખ સુદાલાક્ષ્ય એક લાખ સુદાલાક્ષ્ય (ફિસ્સ ઓફ લોન એકાઇન્ટ નં. SEH.HITPR0000 137 અને ઇપરોક્ત નિર્મારિત વ્યાજ ૧૨,સાથે જ્યાર્ચ લ-મોટીસ પ્રવાગ નિર્મારિત પ્રવાગ નિર્મારિત પ્રવાગ નિર્મારિત પ્રવાગ નિર્મારિત પ્રવાગ નિર્મારિત પ્રવાગ નિર્મારિત પ્રવાગ નિર્મારિત ૧૩(૧) નોટિસ ૧૩(૧) નોટિસ ૧૩(૧) નોટિસ	ઉપરોક્ત રેસીરે-સીયલ મિલકન બેરિંગ જેતપુર, આર.એસ. 1. રેલ્પિકી-ગુ, અને 30પીકી-ગુ કુલ માપ એટિયા રેપ્યુલ્ટ પાટ પેક્રી સીઇ પોર્ટ તેની પેક્રી સીઇ પહેલ તરીકે ઓળખાય. જે પ્લોટ નં. ગુ, ૧૩૧૧. ર- સેન્કર મી. એટલે (૧૫૯.૮ ર સ્કેન્ડર યાડ) જે જેતપુર રિસ્ટ્રીસ્ટ, રાજકોટ માં સિલક છે. સિલકતની ચારે બાજુ: પુર્વ રેલેડ ઉત્તરે: પ્લોટ નં. ૧૨ની મિલકત દક્ષિલો: પ્લોટ નં. ૧૨ની મિલકત દક્ષિલો: પ્લોટ નં. ૧૨ની મિલકત
સ્થળ : જેતપુર, રાજકોટ તારીખ : ૧૦.૧૨.૨૦૨૩		સહી/- અધિકૃત અધિકારી શ્રી રામ હાઉસિંગ ફાયનાન્સ લીમીટેડ

**િ ાCICI** Home Finance એચએકસી ટાવર, અંધરી - કુરલા રોડ, અંધરી (ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૫૯, ઈન્ડિયા.

#### પશ્ચિમ રેલવે – રાજકોટ ડિવિઝન

**સર્કિટ બ્રેકરની જોગવાઈ** નોટીસ નં. ડીઆરએમ/આરજેટી/

हर १९४० साहड इते: 🚹 facebook.com/Western પશ્ચિમ રેલવે – અમદાવાદ કિવિઝન ડેઝર્ટ કુલર્સની જોગવાઈ અને ઈલેક્ટ્રિકલ કામ ઈ-ટેન્ડર નોટીસ નં સિની ઉત્સ્લિએક ઘ**ટાસ ન.** ાસના.ડાદદા) અડાએ ઘ.07-12-2023. <u>અનુંનં.1:</u> ટે -1-એ ઊસાઈ-ટી-87-20 ટ'

**શાખા ઓફિસ** : ચોથો માળ, ૪૧૦, માઈલસ્ટોન વાઈબ્રન્ટ, એપલ હોરિ

જોઈએ. દરાજના નિરીક્ષવના નિર્માય અને શરતો અથવા ટેન્ટર સબમીટ કરવા સંબંધી કોઈપલ વધુ સ્પષ્ટતા માટે કૃપા કરીને ceaocosoo પ આશ્રીકોળાર્થીઆઈ તોમ જાર્યાનાન ઈપની લીમીટેક અવલ અમારા તેલા એન્ડ માર્ટીટીન પાર્ટન્સ NoxXon શોલ્લાનાના ક્રાયદિ હમીટેક નો સંપર્દ કરે... એપ્લિફન અલિકારી કોઈપણ અવલા તમાન બિડ કોઈપલ વધુ કરવાો આવ્યા વિના કાકાવાનો અધિકાર અનામત રામે છે. સેવાલાના વિનાર નિરમો અને શરતો માટે. કૃપા કરીને https://www.iciclific.com/ની મુલાકાલ લો. અધિકૃત અધિકારી આઇસીઆઇસીઆઇસી ક્ષેમ ફાયનાન્સ કંપની લિમીટેડ

તારીખ : ૧૨.૧૨.૨૦૨૩, સ્થળ : સુરત

જામના લોકિકા : સાધા માળ, ૧'૧૦, માઇલસ્ટાન વાઇભર, અપલ લાઇસ્ટલના સામ, ઉપના દરવાળ, સુરત - ૩૯૫૦૦૨. વાલાના (સામા લોક (સિક્સ (દિમા) (સ્ત્રામ (દ)) નો એપલાં જુલો, 'સ્ટિવાર મિલ્લેક્સના વિચાર મોર્ટનો સુચાના કિક્સ (દ્રાદીમાં)એલ એક્સ કેલ્સ્ક્ટલના એફ કાર્યાનાસિયલ એક્સેટ્સ એક્સ એન્ટ્રોલીએન્ટ એક કિક્સોરીટી ઇન્ટરેસ્ટ એક્સ, ૨૦૦૩ ન લેમાન (દ) નો એપલાં ઇનાંડર્ના કિસ્સિટીઇ ઇન્ટરેસ્ટ (અફેબેન્સિટ) સિલ્લા - ૨૦૦૨ હેલા ઈન્ટરોની પ્રદેશ મુંત સામા સિલ્લનોન વેચાયા માટે 1 - હત્રાજી વેચાના નોક્સ. આપી જાહે ૨૯નાને સામાન્ય રીડે અને પાસ કરી કે ઉપાદનાંઓ અને જામીનાદારોને સૂચના આપવામાં અમાર્ચ કે મીચે વર્ષાના લાગ્યાર વિકાસ કિસ્સિટ હેલાદ પાસે નોડોયાં કેલાઈ, પોલે નોક્સ ક્લાને અને ભાગના સ્વાર્થો અને અમાર્ચીઓપાર્ચીઓપાર્થી કોમ કાર્યાનાના ઇપની સિમીટેટ અર્ડી આપેલી સંવિપત વિગતો મુજન "એમ છે ત્યા", "એમ છે તે પ્રમાણે" અને "એ છે તે"

કંધ્ર હોચ તો (C) કલેટ નં. બી/૧૦૦, પહેલો માળ વિંગ - બી, ''સોમનાથ રેસીરેન્થી' થી જાશીતી, બ્લોક નં. ૮૮, પ્લોટ નં. ૧૧૧ અને ૧૧૭, બ્લોક નં ૯૩, પ્લોટ નં. પ્યી ૧૨ રજ્યરેશન જીલ્લો અને સબ જીલ્લો (D)

# **REC along with BOI to cofinance** projects worth Rs 30,000 cr in next 5 yrs



(dixitpatrakar@yahoo.in)

dixitpatrakar@yahoo.in)

Bank of India (BOI) inked

Bank of India (BOI) inked

Bank of India (BOI) inked

collaboratively investigate the
potential for financing projects
in industries including power,
infrastructure, and logistics
under a consortium
arrangement. Over the next
few years, BOI and REC will
work together to co-finance
loans totalling Rs 30,000

crore. Bank of India is a Public
Sector Bank and doing banking
Business including funding
infrastructure projects across
the country with a worldwide
presence.

resence. The infrastructure continues to be the focus to push the economic growth rates in India. The financial rates in India. The financial institutions such as India Infrastructure Finance Company Ltd (IIFCL), Rural Electrification Corporation (REC), Bank of India, and others that have been investing in the different infrastructure sectors and the projections about

Infrastructure sectors and the projections about infrastructure sector by CRISIL. It also provides a quick snapshot of the major happenings in sectors like aviation, energy storage, roads, metros and others across the country. include Non-Power Founded in 1906, BoI has Infrastructure, which includes

made rapid growth over the years and blossomed into a mighty institution with a strong national presence and sizable

mighty institution with a strong national presence and sizable international operations. In business olume, the Bank occupies a premier position among the nationalized banks as Global Gross Business a Global Gross Business of Over Rs. 12.14

Shri T.S.C. Bosh, Executive Director (Infra & Logistics), REC and Shri Nitin G, Rec. Shri Nitin G, Shri Nitin G, Rec. Shri Rajnees Kumar Dewangan, CMD, REC, Shri Rajnees Kumar Dewangan, CMD, REC, Shri Rajnees Kamatak, MD & CEO, Bol, Shri Ajoy Choudhury, Director (Finance), REC and other senior officials from REC and Bol. Under the Ministry of Power, REC Limited, 12th Maharatha CPSE founded in 1969, offers long-term loans and other finance products for the Power Infrastructure segments, which include Generation, Transmission, Distribution, Renewable Energy, and New Technologies in recent itmes, REC has expanded its business to include Non-Power Infrastructure, which includes

transportation infrastructure such as roads and motorways, metro rail, airports, IT communication, social and commercial infrastructure commercial intrastructure (hospitals, educational institutions), ports, and electro-mechanical works associated with different industries like steel and refineries. REC has more than Rs 4,54,393 crore in loans on file. Earlier REC signed deals to finance two green

rile. Earlier REC. signed deals to finance two green hydrogen, and a thermal project worth Rs 40,000 crore. REC signed an MoU with Odisha Power Generation Corporation (OPGC) to finance Rs 9,538 crore for declaract of the units of a Odisha Power Generation COPGC) to finance Rs 9,538 crore for development of two units of a thermal power project in Jharsuguda, Odisha. Under a partnership with Acme Group, REC will provide a funding of Rs 16,000 crore for a green hydrogen and ammonia facility proposed at Gopalpur in the state.

There is no doubt that the collaboration between BOI & REC will contribute significantly to the state's power generation capacity and energy infrastructure. (B-15 yoti-Kallash Society, Jodhpur Tekra Satellite, Ahmedabad - 380 015)

#### Max Life Launches Smart Total **Elite Protection Term Plan**

Ahmedabad, Max Life Insurance Company Ltd. ("Max Life"/ "Company"), has announced the launch of Smart Total Elite Protection Plan (UIN – 104N125V01), a nprehensive life insurance in plan crafted for today's

lifestyles, providing comprehensive coverage, comprehensive coverage; tailored to evolving consumer preferences. A non-linked, non-participating, individual pure-risk premium life insurance plan, Max Life Smart Total Elite Protection Term Plan ("STEP") offers policyholders multiple enhanced benefits like Instant Payment on Claim Intimation, Cover Continuance Benefit and Special Exit Value. This plan aims to enhance financial

on Term Plan
noticeable shift in consumer
preferences towards premium
products and services, 3 out of
5 Indians express concerns
about sustaining their lifestyle
and expenses with current
earnings (Max Life IPQ 5.0
survey). This trend is also
reflected in the growing
demand for higher coverage
solutions amongst consumers
to safeguard the well-being of
their families. For instance,
more than one-third of Max
Life's customers have chosen a
term plan with a coverage of
INR 2 crores this year, compared
to one-fourth in the previous
year. In this context, STEP
emerges as a vital solution. The
Offering inherently builds for an
enhanced coverage of INR
2 crores keeping in line with the
growing financial needs of
consumers while introducing
pontions for flexibility such as plan aims to enhance financial cross keeping in line with the security in today's landscape, addressing the modern consumers need for increased protection through higher coverage solutions.

As India experiences a surge in aspirations and a benefit. (22-2)

Go Nisha Go Wins 'Best Serious



named "Best Serious Game" at theGala2023 Serious Games competition in Dublin, Ireland. Led by Howard Delafield International (HDI), itwas created by the USAID-funded Game of Ahmedabad, Go Nisha Go, a mobile game designed with and for adolescent girls in India, was

said that the plant will be fully automated using robotic technology. The facility will be enabled with Internet of Things (10T) and machine-learning technology enabled devices to enable real-time monitoring and control of the manufacturing processes. It GANDHINAGAR: American multinational beverage manufacturer The Coca Cola Company (TCCC) will invest Rs 3,000 crore to

will invest Rs 3,000 crore to set up a beverage bases and concentrates plant in Sanand situated 22km from Ahmedabad. The foreign direct investment (FDI) will be made by the company through International Refreshments monitoring and control of the manufacturing processes. It will also have automated storage and retrieval systems. During the construction phase, a workforce of about 1,000 persons - both skilled and unskilled - will be employed by the company. When operational, the plant will have a workforce of about 400 persons in operational and engineering

mace by the company through International Refreshments (India) Phyate Limited (IRIPL), part of TCCC. Sources in the state government confirmed that a plot of land (SM-52) measuring 1.6 lakh square metre has been allotted to the company to establish the plant in Sanand Industrial Estate-II. "Coca Cola has already made two large investments through its bottling partners in Gujarat. The government has fast tracked the process of approvals and has already made land allotment to the company," senior officials in the state administration said. The company already

the state administration said.
The company already has a facility in Goblej, situated some 33km from Ahmedabad, through its bottling partner - Hindustan Coca Cola Beverages Limited, in addition to another one at Sanand. The two facilities were established with a cumulative established with a cumulative investment of \$180 million.

Government sources

RAKESH V. SWADIA CHAIRMAN CUM MANAGING DIRECTOR DIN: 00356657

RANJEET MECHATRONICS LIMITED

Registered Office: Block A, Office No: 407, Dev Aurum, Anand Nagar Char Rasta, Prahlad Nagar Road Ahmedabad Gujarat 380015 Email: cs. compliance@anajeet.co.in Tel: 079 4000 9390; Web: www.ranjeet.co.in

CORRIGENDUM TO THE NOTICE OF THE ANNUAL GENERAL MEETING OF THE COMPANY

MEITING OF THE COMPANY
We draw attention of all the Shareholders of RANLEET MECHATRONICS
LIMITED (The Company) towards the Notice circulated on November 21,
2023 (Notice of AGM) issued for convening the Annual General Meeting of
the Shareholders of the Company on Wednesday, 13th December 2023 at
12:00 PM, (IST) a registered office. The Notice of the AGM has been diagsatched
to the Shareholders of the Company in due compliance with the provisions of
the Companies AC, 2013 read with the relevant rules made thereunder and
relevant circular sissed by Ministry of Corporate Affairs and Securities
Echange Board of India

# Coca Cola to invest Rs 3,000 crore to set up plant in Sanand



operational and engineering roles, with an emphasis on gender diversity.

"The beverages major has created several employment opportunities through at least two lakh retailers and direct and indirect jobs for 1,000 persons in Gujarat thus far," said a source. The new plant is expected to give a boost to ancillary industries such as packaging suppliers, flavour producers, engineering services, capital goods, and automation sectors, sources in the government said.
"Coca Cola has already made two large investments through its bottling partners in Gujarat. The government has fast tracked the process of approvals and has already made land allotment to the company," senior officials in the state administration said.

company," senior officials in the state administration said. The company already has a facility in Goblej, situated

SHRIRAM HOUSING FINANCE LIMITED

Reg. Off.: Office No.123, Angappa Naicken Street, Chennai-60000

Head Office: Level 3, Wockhardt Towers, East Wing C-2 Block
Bandra Kurla Complex, Bandra (East), Mumbail 400 051.

Website: www.shirizambnusing in

PHYSICAL POSSESSION NOTICE Whereas, The undersigned being the authorised officer of Shriram Housing Finance Limited (SHFL) under the provisions of the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (said Act) and in exercise of powers conferred under Section 13(12) of the said Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 (said Rules) issued demand notices to the Borrowers details of which are mentioned in the table below to repay the amount mentioned in the said demand notices.

notices. The Borrowers having failed to repay the amount, notice is hereby given to the Borrowers and the public in general that. The Authorised Officer of Shriram Housing Finance Limited has taken the Physical possession of the property described in the possession notice in exercise of powers conferred on him, pursuant to the direction passed by The Chief Judicial Magistrate, Rajact in Criminal Misc Application No.2602/2023, Judgerenar Dated 0.011/2023 under Sarfaesi Act.2002 under Section 14 and under Section 13(4) of the Securitisation and Reconstruction of Financial Assessi and Enforcement of Security Interest Act. 2002, on this Date 1.0.12.2023.

The Borrower in particular and the public in general is hereby cautioned no to deal with the property and any dealing with the property will be subject to the charge of Shriram Housing Finance Ltd. for an amount as mentioned herein below with interest thereon.

The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.							
Borrower Name & Address	Amount due as per Demand Notice	Description of Mortgaged Property					
1. Budhadev Varshaben Bharatbhal, 2. Budhadev Yash Bharatbhal, 2. Budhadev Mihir Bharatbhal, Address No. 1.2 & 3: Street No. A/3, Fulwadi Road, Patel Samaj Pase, Jetjur, Rajkold-300370 Also Address No. 1.2 & 3: Plot No. 13, "Street Gajanan", Shreeji Park, Behind Kumar Residency, Off. Lunagadh Road, Naer Jio Tower, Area: Fasjkot, Also Address No. 1: Bajkot, Also Address No. 1: Bajkot, Also Address No. 1: Budhadev Varshaben Bharatbhal, Address: Nds Zone, Pankaj Nitings Complex, Matwa Street, Jelpur, Klajkot-360370 Address No. 1: Budhadev Varshaben Bharatbhal, Address Fides Zone, Pankaj Nitings Complex, Matwa Street, Jelpur, Klajkot-360370 Address Pankot-360370 Address Pankot-	Rs. 33, 5, 9, 38 B/.  (Ruppes Thirty Three Lakh Fifty Nine Lakh Fifty Nine Housand Three Hundred Niney Eight Hundred Niney Eight Hundred Niney Eight Hundred Niney Eight Hundred State Hundred Only as on 0806/2023 under reference of Loan No. SHL1JTPR000012 1 and Rs.147.241/- (Ruppes Sone Lakh Totyl Hundred Forty Only Seven Thousand No Hundred Seven	The Said Residential Property bearing Jetpur, R.S.No.29/Pails-3, & 30/Pails-3, bearing Jetpur, R.S.No.29/Pails-3, & 30/Pails-3, bear 25935.00 Residential Purpose N.A.Land Purpose N.A.Land Purpose N.A.Land Pails Known as "Shreel P					
· · · · · · · · · · · · · · · · · · ·							

Date: 10-12-2023 Shriram Housing Finance Limited

PICICI Home Finance | Corporate Office: ICICI Home Finance Company Limited ICICI HFC
Tower, Andheri - Kurla Road, Andheri (East), Mumbai - 400059, India
Branch Office: 4th Floor, 410, Milestone Vibrant, Oop, Apole Hospital, Udnha Darwaja, Surat-395002

viorant, Opp. Apple Hospital (U [See proviso to rule 8(6)] Notice for sale of Immovable assets ce for Sale of Immovable Assets under the Securitization ment of Security Interest.

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitization and National Assets and Enforcement of Security Interest Act, 2002 read with proviso to Rule 8 (6) of the Security Interest (Enforcement) Rules, 2002.
Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guaranto(s) that the below described immovable property mortgaged/charged to the Secured Creditor, the Physical Possession of which has been taken by the Authorized Officer of IJCI Home Finance Company Ltd, will be sold on "As is where is," As is what is," and "Markever there is," as per the brief particulars given hereunder; where is, "As is what is," and "Markever there is," as per the brief particulars given hereunder;

Details of the Amount Reserve Date and Date & Time of T

Sr. No.	/Co Borrowers/ Guarantors/ Legal Heirs. Loan Account No.	Details of the Securedasset(s) with known encumbrances, if any (C)	Amount Outstanding (D)	Reserve Price Earnest Money Deposit (E)	Date and Time of Property Inspection (F)	Date & Time of Auction (G)
1.	Janmajay Das (Borrower) Tilattama Das (Co-Borrower) Loan Account No. LHSUR00001313059	Flat No. B/107 On First Floor In Wing B, Known as "Somnath Residency", Block No. 88, Plot No. 111 & 117, Block No. 93, Plot No. 5 to 12 At Registration District & Sub-District Palasna & District Surat	Rs. 9,09,359/- December 07, 2023	Rs. 4,27,680/- Rs. 42,768/-	18, 2023	December 29, 2023 02:00 PM- 03:00 PM

agency Globe Tech. The Mortgagors notice are given a last chance to pay the total dues with further interest till December 29, 2025 before 5.00 PM. Alse these secured assets will be sold as per above schedule. The Prospective Bidder(s) must submit the Earnest Monsy disposit (EM) (PS) bemand to SC (Semand NCS) bemand (CS) per and (CS) per a

Darwaja, Surat-395002 on or before December 28, 2023 before 05:00 P.M. Earnest Money Upopost upersand praft (DD) should be from a Nationalized/Scheduled Bank in favor of "ICICH Home Finance Company Ltd. Auction" payable at Surat.

For any further califications with regards to inspection, terms and conditions of the auction or submission of tenders, kindly contact ICICH Home Finance Company Llimited on 9920807300 or our Sales & Marketing Partier NexzAm Solutions Private Limited.

The Authorized Office reserves the right in spect any or all the between the submission of the sale, please visit https://www.icichific.com/

Date : December 12, 2023 Place : Surat Authorized Office ICICI Home Finance Company Limited

#### **ASCI** and the Unstereotype Alliance **Unveil Study on Diversity & Inclusion**

Ahmedabad, The Advertising Standards Council of India (ASCI) and the UN Women convened Unstereotype Alliance (UA), launched their Collaborative study on Diversity and Inclusion (D&I) in Indian advertising. The report, prepared by Kantar, a global prepared by Kantar, a global brand research partner to the world's leading companies, deep dives into a critical component of ESG (environmental, social and governance) goals of corporates. The study was unveiled at the DEI Edge Summit, co-hosted by ASCI and UA, and supported by organisations such as Diageo, HUL and Disney Star.

Manisha Kapoor, CEO and cretary-General, ASCI, said, Manisha Kapoor, CEU and Secretary-General, ASCI, said, "There is no doubt that advertising shapes society. Indian advertising is missing the Diverse and inclusive narratives that can provide a real edge to brands, as can real edge to brands, as can be seen in the study. Along with The Unstereotype Alliance and other partners, ASCI would like to nudge and support the advertising industry in getting its DEI representation right. The opportunity to include diverse perspectives and stories is a opportunity to include diverse perspectives and stories is a powerful one, and the event showcases the immense benefits both brands and society can derive from such progressive inclusions." (13-9)

#### Hiten Bhuta: Bridging Ancient Wisdom and Modern Science for Today's World



Ahmedabad, Hiten Bhuta Anmedabad, ritten Bhuta stands out as a visionary, bringing the ancient teachings of Adi Shankaracharya into the 21st century with a unique approach. His work, which includes conducting 121 indepth study sessions, is a testament to his commitment to reviving these timpless. testament to his commitment to reviving these timeless teachings. What sets Bhuta apart is his ability to intertwine these ancient philosophies with modern scientific concepts from neuroscience and quantum physics, making them more understandable and relevant to a contemporary audience. Atma Shatakam Series: A Journey Beyond Physical Existence. In his Atma Shatakam series, Bhuta offers practical steps to help individuals experience their

nce beyond the physical body. He suggests that many of our health, family, social, and global issues stem from the belief that we are solely our bodies. By recognizing our true nature beyond physical constraints, Bhuta argues, we can achieve a sense of liberation

can achieve a sense of liberation.

Atma Bodh: Understanding the Infinite Self- The Atma Bodh series, comprising 68 verses, delves into the profound nature of the human self. Bhuta describes this as a space of creation, where we are not confined to a fixed identity or physical form. Instead, we are part of a vast, infinite existence. Through this series, Bhuta shares steps to connect with our essence, tapping into our infinite energy and wisdom. (13-9)

Printed and Published by MAYUR C. BHATT on behalf of KALYANI PUBLIATION PVT. LTD. and Printed at: 5 Dharti Printers C-3, Shankar Chember, Nr. Fadia Chamber, Asharam Road, Ahmedabad-Published From KALYANI PUBLIATION PVT. LTD. 201, 202, 208 Nardam complex, opp mithakhali ry crossing, mithakhali, ahmedabad-Editio: Mayur C.

#### Presstonic Engineering plans to raise up to Rs. 23.30 crore from IPO



Ahmedahad, Presstonio Ahmedabad, Presstonic Engineering Ltd engaged in the manufacturing of Metro Rail Rolling Stock, Metro Rail Signalling, and Infrastructure plans to raise Rs. 23.30 crore from its SME public issue. The public issue will open for subscription on December 11 subscription on December 17.

The company has received approval to launch its public issue on NSE Emerge Platform of National Stock Exchange. Proceeds of the public issue will be utilized for Funding Capital Expenditure towards the purchase of additional plant and purchase or additional plant and machinery, prepayment of borrowings, meet working capital requirements and for general corporate purposes. Finshore Management Services Limited is the lead manager of

30 crore from IPO
the issue, Public issue will close
on December 13. The initial
public offering comprises of a
fresh issue of 32,36,800 equity
shares of face value Rs. 10 each
at a price of Rs. 72 per share
(including a premium of Rs. 62
per equity share) aggregation
to state of the application is 1600
shares which translates in to
investment of Rs. 1.15 lakh per
application. Retail allocation for
the IPO is kept each at 50% of
the issue. Market maker
reservation portion is 1,63,200
quity shares. Incorporated in
1996, Presstonic Engineering
Limited manufactures products
for Metro Rail Rolling Stock,
Metro Rail Signalling, and
Infrastructure. The company
offers a wide range of products,
including Rolling Stock,
metro Rail Rolling Stock,
metro Rail Signalling, and
Infrastructure. The company
offers a wide range of products,
including Rolling Stock Litation oriers a wide range of products, including Rolling Stock Interior Products such as Saloon Bucket/ Plain Type Seats, Custom Colored Engineered Handles, Grab Pole Systems, Hand Rail Systems, Emergency Evacuation Ramps, and Honeycomb Partition Panels. (18-2)

#### 15 YOUTHS FROM FIVE COUNTRIES TRIUMPHED AT YOUNG SOCIAL ENTREPRENEURS



Ahmedabad, Six social enterprise teams from five countries emerged as winnersat this year's Young winniesat uis year's froing Social Entrepreneurs (YSE) Global Programme organised by the Singapore International Foundation (SIF). The teams were represented by 15 youths from China, India, Indonesia, Laos, and Singapore. Ms Mahdiyyah Ardhina. a member of Rumah Ardhina harmber of Rumah Ardhina, a member of Rumah Briket and YSE 2023 participant from Indonesia said: "YSE Global has been an intensive boot camp for our team as we are still new in our business. We thank our mentors for their experience mentors for their experience and input. They have been invaluable these past few months. They imparted

critical knowledge based on years of professional experience and provided fresh experience and provided fresh perspectives on our business plans." Rumah Briket created a zero-waste solution that processes organic and non-organic waste and converts it into charcoal briquettes and paving blocks. They presented the strongest business ideas that addressedsocial and environmental causes that addressedsocial and environmental causes includingmental health services, water conservation, the provision of skills and technology for underserved communities, and women empowerment. The YSE Global Programme also

the Companies Act, 2013 read with the develor frue sine de interculor and interception of the companies Act, 2013 read with the develor frue sine described sections and the companies of India and Ecchange Board of India Intercept on the Companies of India and Disclosure Requirements) Regulations, 2018: With respect to Item No. 3 of the assembling the property of the Companies o Date: 11-12-2023 Place: Ahmedabad WESTERN RAILWAY - RAJKOT DIVISION

PROVISION OF CIRCUIT BREAKER Pr Notice No. DRM/RJT/E /EL/TRD/2023-2024/23 Dt.05-12 Tender No. DRM-RJT-EL-TRD 4-23 (i) Name of Work: Provision uit Breaker at Dahinsara SP fo

Like us on: f facebook.com/WesternRlv

WESTERN RAILWAY - AHMEDARAD DIVISION as part Drawing No SKO/1728/VTAM: 14 at Loop Shed Valva (9) Estimated Cost of Work: 18,38,372- (4) Cost of Tender Cost of Work: 18,38,372- (4) Cost of Tender Money Document: NI (9) Earnest Money Competition (19) Earnest Money Competition: 03 Months (7) Last date of Loop Shed Valva (19) Earnest Money Competition: 03 Months (7) Last date of Loop Cost (19) Earnest (1

Follow us on: IXI twitter.com/WesternRlv